

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી
(ગુજરાત એક્ટ નં. ૨૪/૨૦૧૫ દ્વારા સ્થાપિત)
Shri Govind Guru University
(Established vide Gujarat Act No. 24/2015)

સરકારી પોલિટેકનીક કેમ્પસ
ગદકપુર, ગોધરા
જિલ્લો પંચમહાલ પિન કોડ ૩૮૯૦૦૧

Government Polytechnic Campus
Gadukpur, Godhara
Dist. Panchmahals Pin Code 389001

બોગસ/ અમાન્ય કોલેજ-સંસ્થા-યુનિવર્સિટીથી સતર્ક રહેવા અપીલ.

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરાના કુલસચિવશ્રીની એક યાદી જણાવે છે કે, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની સ્થાપના ગુજરાત સરકારશ્રી દ્વારા ગુજરાત એક્ટ ૨૪/૨૦૧૫ થી કરવામાં આવેલ છે અને આ યુનિવર્સિટીનું વડુ મથક ગોધરા, જિલ્લો પંચમહાલ છે. આ યુનિવર્સિટીના કાર્યક્ષેત્રમાં પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાઓનો (એમ. એસ. યુનિવર્સિટી સિવાયનો વિસ્તાર) સમાવેશ થાય છે. આ પાંચ જિલ્લાઓમાં આવેલ અને ઉચ્ચ શિક્ષણની સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના બી. એ., બી. કોમ., બી. એસ. સી., બી. એડ., બી. ફીઝીયો., બી. એસસી. નર્સિંગ, પોસ્ટ બેઝિક બી. એસસી. નર્સિંગ, એમ. એ., એમ. કોમ., એમ. એસસી., એમ. એડ., એમ.એસ.ડબલ્યુ. જેવા વિવિધ અભ્યાસક્રમો ચલાવતી તમામ કોલેજો/સંસ્થાઓએ ફક્ત ને ફક્ત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની માન્યતા અને જોડાણ મેળવવાનું રહે છે.

આ વિસ્તારની ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરતી કોઈપણ કોલેજ અન્ય યુનિવર્સિટીનું જોડાણ કે માન્યતા સ્નાતક કે અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો ચલાવવા માટે મેળવી શકતી નથી કે આવા અભ્યાસક્રમો ચલાવી શકતી પણ નથી. જો કોઈ કોલેજ કે સંસ્થા શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની માન્યતા કે જોડાણ મેળવ્યા સિવાય ઉચ્ચ શિક્ષણના સ્નાતક કે અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો કોલેજ સ્વરૂપે કે સ્ટડી સેન્ટર સ્વરૂપે કે કાઉન્સિલીંગ સેન્ટર તરીકે કે અન્ય કોઈ સ્વરૂપે ચલાવતા હોય તો તે તદ્દન ગેરકાયદેસર છે અને તેમના દ્વારા આપવામાં આવતી સ્નાતક કે અનુસ્નાતકની ડીગ્રી અમાન્ય ડીગ્રી છે.

તાજેતરમાં ગુજરાત રાજ્યમાં માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ -૧૨ના પરિણામો બહાર પાડવામાં આવનાર છે. જેથી પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર અને વડોદરા જિલ્લાઓના વાલીઓ તથા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની સ્નાતક કે અનુસ્નાતકની પદવીઓમાં પ્રવેશ મેળવતી વખતે મુશ્કેલી ઉભી ના થાય અને તેઓ અમાન્ય કે બોગસ કોલેજ/સંસ્થાઓમાં ચાલતા અમાન્ય કે બોગસ સ્નાતક/અનુસ્નાતક પદવી ના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી છેતરાય નહિ તે માટે જાહેર હિતમાં ગુજરાત સરકાર તેમજ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા ચેતવણી આપવામાં આવે છે કે આ પ્રકારની બોગસ કે અમાન્ય અભ્યાસક્રમો ચલાવતી કોલેજ, સંસ્થા કે યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવો નહિ તેમજ તેઓના લેભાગુ એજન્ટો કે તત્વોની વાતોથી ભરમાવું નહી.

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી
(ગુજરાત એક્ટ નં. ૨૪/૨૦૧૫ દ્વારા સ્થાપિત)
Shri Govind Guru University
(Established vide Gujarat Act No. 24/2015)

સરકારી પોલિટેકનીક કેમ્પસ
ગદકપુર, ગોધરા
જિલ્લો પંચમહાલ પિન કોડ ૩૮૯૦૦૧

Government Polytechnic Campus
Gadukpur, Godhara
Dist. Panchmahals Pin Code 389001

ઓપન અને ડીસટન્સ લર્નિંગ એટલે કે ઘર બેઠા ઉચ્ચ શિક્ષણના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશની મંજૂરી ફક્ત જે તે રાજ્યની રાજ્ય સરકાર દ્વારા સ્થાપવામાં આવેલ સ્ટેટ ઓપન યુનિવર્સિટી જ આપી શકે છે અને તે જે રાજ્ય સરકાર દ્વારા સ્થાપવામાં આવી તે રાજ્યોમાં જ પોતાના સ્ટડી સેન્ટરો સ્થાપી અને ઉચ્ચ શિક્ષણના વિવિધ અભ્યાસક્રમોની ડીગ્રી આપી શકે છે. કોઈપણ રાજ્ય સરકાર દ્વારા સ્થાપવામાં આવેલ કે માન્યતા આપવામાં આવેલ ડીમ્સ કે પ્રાઇવેટ યુનિવર્સિટી તેના મેઈન કેમ્પસની બહાર યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનની પૂર્વમંજૂરી વગર સ્ટડી સેન્ટરો સ્થાપી વિવિધ અભ્યાસક્રમો ચલાવી શકતી નથી.

આમ, વાલીઓએ પોતાના સંતાનોને ઉચ્ચ શિક્ષણના વિવિધ અભ્યાસક્રમોમાં દાખલ કરતા પહેલા ઉપર મુજબની ચકાસણી કરવી ખુબ જ આવશ્યક છે જેથી તેમના સંતાનોનું ભાવી અંધકારમય ન બને. સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓની વિગતવાર માહિતી UGC ની વેબસાઈટ www.ugc.ac.in પર પણ ઉપલબ્ધ છે.

ગોધરા કુલસચિવ
૧૮/૦૫/૨૦૧૬ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી

ગોધરા